

001. **To keep well**

Meaning:- To be in good health

ગુજરાતી અર્થ:- સ્વસ્થ હોવું

Example:- I am keeping well in winter's days.

002. **A wet blanket**

Meaning:- A person who often dampens the excitement, excitement, or enjoyment of others by being pessimistic, negative, or overly critical.

ગુજરાતી અર્થ:- એવી વ્યક્તિ જે અન્ય લોકોના ઉત્સાહ, ઉત્તેજના અથવા આનંદને ઘટાડે છે, આવી વ્યક્તિ નિરાશાવાદી, નકારાત્મક હોય છે તે વધુ પડતી ટીકા કરીને આવું કરે છે..

Example:- Don't invite Yogesh to the party; he's such a wet blanket and always complains about everything.

003. **A hot potato**

Meaning:- A controversial issue or difficult topic that people avoid discussing because it is sensitive, divisive, or might cause disagreement.

ગુજરાતી અર્થ:- વિષમ પરિસ્થિતિ, ભયંકર સ્થિતિ/ વસ્તુ

Example:- The topic of raising taxes has become a hot potato for the government.

004. **A stag party**

Meaning:- A party where only men are allowed to be present

ગુજરાતી અર્થ:- ફક્ત પુરુષોની ગોષ્ઠી/ મીલન

Example:- We are going to have a stag party this weekend.

005. **A hen party**

Meaning:- A party where only women are allowed to be present

ગુજરાતી અર્થ:- ફક્ત સ્ત્રીઓની ગોષ્ઠી, મીલન

Example:- Sudha is going to Sneha's hen party.

006. **To give up**

Meaning:- To stop trying to achieve something, to admit defeat, or to give in. It can also mean to abandon an effort, activity, or pursuit.

ગુજરાતી અર્થ:- કંઈક હાંસલ કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરવું, છોડી દેવું. તેનો અર્થ એવો પણ થઈ શકે છે કે કોઈ પ્રયાસ, પ્રવૃત્તિ અથવા ધંધો છોડી દેવો.

Example:- After several failed attempts, Radhika decided to give up on solving the puzzle.

007. **Hit the nail on the head**

Meaning:- Describe or state something precisely or point out the most accurate or relevant point in a discussion or situation.

ગુજરાતી અર્થ:- કોઈ વસ્તુનું બરાબર વર્ણન કરવું અથવા ચર્ચા કે પરિસ્થિતિમાં સૌથી સચોટ અથવા સંબંધિત મુદ્દાને સૂચવવા.

Example:- When Radhika said the project failed because of poor planning, she hit the nail on the head.

008. **Hit the sack**

Meaning:- Going to bed or falling asleep. This is an informal way of saying that someone is going to rest for the night.

ગુજરાતી અર્થ:- સુઈ જવું

Example:- Radhika decided to hit the sack early to prepare for his meeting in the morning.

009. **It takes two to tango**

Meaning:- Both people involved in a bad situation or argument, and both are responsible

ગુજરાતી અર્થ:- એક હાથે તાળી વાગતી નથી. કોઈ પણ ખરાબ સ્થિતિ કે ઘટના માટે બંને વ્યક્તિ જવાબદાર હોવા

Example:- Mehul blames to Rahul for their fight at play ground, but it generally takes two to tango.

010. **A penny for your thoughts**

Meaning:- Way of asking what someone is thinking

ગુજરાતી અર્થ:- મનની વાત જાણવી/ વિચારો રજૂ કરવા કહેવું

Example:- You seemed pretty pleased, a penny for your thoughts.

011. **A willing horse**

Meaning:- Someone who is hardworking, eager, and willing to take on tasks or responsibilities, often so much so that they are willing to shoulder a heavy burden.

ગુજરાતી અર્થ:- કોઈના માટે સખત મહેનત કરનાર, વિપરીત પરિસ્થિતિમાં સ્વેચ્છાએ સાથ આપનાર

Example:- Radhika is a willing horse who never complains, even when given extra work.

012. **Cost an arm and leg**

Meaning:- Very expensive, a very large and exorbitant sum of money

ગુજરાતી અર્થ:- ખુબ જ ખર્ચાળ

Example:- I would very like to have a new car, but it may cost me an arm and leg.

013. **A wild goose chase**

Meaning:- A search for something which has no chance to being successful

ગુજરાતી અર્થ:- નિરર્થક શોધખોળ કરવી. સફળતા મળવાની શયતા ન હોવા છતા મથ્યા કરવું

Example:- Rambabu is looking for his lost mobile phone may be on a wild goose chase.

014. **To breakdown**

Meaning:- To collapse

ગુજરાતી અર્થ:- પડી ભાંગવું

Example:- There has been a breakdown of relation with China that resulted in the loss of several million dollars.

015. **To break out**

Meaning:- To erupt suddenly

ગુજરાતી અર્થ:- એકાએક ફાટી નીકળવું

Example:- Last night, fire broke out in the factory.

016. **To look into**

Meaning:- To investigation

ગુજરાતી અર્થ:- તપાસ શરૂ કરવી

Example:- The very intelligent police officer Shri Rav is looking into the matter.

017. **A sweeping statement**

Meaning:- A statement which is not careful or correct on its details, a generalisation

ગુજરાતી અર્થ:- કાળજી વગરનું નિવેદન, અતિશયોક્તિપૂર્ણ નિવેદન, તથા વગરનું સામાન્યીકરણ

Example:- Making a generalised and sweeping statement on caste is an irresponsible act.

018. **At someone's beck and call**

Meaning:- Ready to do something for someone any time.

ગુજરાતી અર્થ:- કોઈ પણ સમયે મદદ કરવા હમેંશા તૈયાર રહેવું

Example:- Grandmother was confined to a wheel chair but had a private nurse at her beck and call.

019. **At the drop of hat**

Meaning:- To do something immediately, without hesitation, or without prompting. It conveys a sense of eagerness or readiness to do the job quickly.

ગુજરાતી અર્થ:- તરત જ કંઈક કરવું, ખચકાટ વિના. ઝડપથી કામ કરવાની આતુરતા અથવા તત્પરતાની ભાવના વ્યક્ત કરવી.

Example:- Radhika is always ready to help at the drop of a hat whenever someone needs her.

020. **A toll order**

Meaning:- A request which is unreasonably difficult to grant or carry out.

ગુજરાતી અર્થ:- ગેર વ્યાજબી કે સંતોષી ન શકાય તેવી માગણી/ જરૂરીયાત

Example:- To score four goals in this game is a tall order, even for Hemraj.

021. **To take off**

Meaning:- To begin a flight

ગુજરાતી અર્થ:- ઉપર ઉડવાનું ચાલું કરવું

Example:- The plan was able to take off despite the rain.

022. **To stand by**

Meaning:- To support

ગુજરાતી અર્થ:- મદદ કરવી, પડખે રહેવું

Example:- We should stand by to one another in the time of natural calamity.

023. **To put off**

Meaning:- To postpone

ગુજરાતી અર્થ:- મુલતવી રાખવું

Example:- We have to put off our tour due to bad climate.

024. **At a snail's pace**

Meaning:- Moving or progressing very slowly, often frustratingly. It is used to describe anything that lacks speed or efficiency.

ગુજરાતી અર્થ:- ખૂબ જ ધીરે ધીરે આગળ વધવું અથવા પ્રગતિ કરવી, ઘણી વખત નિરાશાજનક રીતે પ્રગતિ માટે વપરાય છે. ઝડપ અથવા કાર્યક્ષમતાનો અભાવ હોય તેવી કોઈપણ વસ્તુનું વર્ણન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ગોકળગાયની ઝડપ.

Example:- The project is progressing at a snail's pace because of the constant delays.

025. **Back to the drawing board**

Meaning:- Start something all over again

ગુજરાતી અર્થ:- કોઈ કાર્યની ફરીવાર પહેલેથી જ શરૂઆત કરવી

Example:- If my proposal is not accepted, I will go to back to the drawing board.

026. **To call on**

Meaning:- To meet

ગુજરાતી અર્થ:- મળવું

Example:- We should call on to our manager for this issue.

027. **To drop in**

Meaning:- To pay sudden visit

ગુજરાતી અર્થ:- અચાનક મુલાકાત લેવી

Example:- The CEO of the company dropped in to branch office.

028. **To bring up**

Meaning:- To educate or to rear

ગુજરાતી અર્થ:- શિક્ષણ આપવું અથવા ઉછેર કરવો

Example:- Neha is struggling to bring up two children alone.

029. **To carry on**

Meaning:- To manage or continue

ગુજરાતી અર્થ:- વ્યવસ્થા કરવી અથવા ચાલુ રાખવું

Example:- Surekha carried on her business after accident.

030. **To cast off**

Meaning:- To drive away

ગુજરાતી અર્થ:- દૂર કરવું

Example:- We must cast off the evils of the society.

031. **A sore point**

Meaning:- A matter which irritate or hurts or angry or uncomfortable when it is mentioned

ગુજરાતી અર્થ:- એવી બાબત કે જે દુઃખી કરનારી હોય, ગુસ્સો અપાવનારી અથવા બેચેની લાવનારી હોય

Example:- Don't ask Rajesh about the job search, it is a bit of a sore point.

032. **Hush Money**

Meaning:- Money paid as a bribe to keep a matter secret from the public

ગુજરાતી અર્થ:- કોઈ બાબતને જાહેરમાં નહીં લાવવા માટે આપવામાં આવતી લાંચ પેટેની રકમ

Example:- There are some businessmen are paying hush money to the ruling party.

033. **Ball in your court**

Meaning:- The moment when someone has the responsibility of taking the next action or making the next decision

ગુજરાતી અર્થ:- હવે પછીનું પગલું કે નિર્ણય લેવાની કોઈ વ્યક્તિની જવાબદારી

Example:- I sent the proposal to Nitin Patel for partnership in business, so the ball is in his court now.

034. **A fish story**

Meaning:- An untrue tale, an unlikely story

ગુજરાતી અર્થ:- અસત્ય, નિરર્થક વાત

Example:- This is fish story that storm is coming tonight.

035. **To get through**

Meaning:- To pass

ગુજરાતી અર્થ:- ઉત્તિર્ણ થવું

Example:- Hemraj worked hard to get through the GPSC examination.

036. **To keep back**

Meaning:- To conceal or hide

ગુજરાતી અર્થ:- છુપાવવું

Example:- I shall keep back nothing from you.

037. **To pass through**

Meaning:- To undergo

ગુજરાતી અર્થ:- પસાર થવું

Example:- Alichacha passed through many ups and downs in his life.

038. **To turn a deaf ear to**

Meaning:- To ignore

ગુજરાતી અર્થ:- અવગણના કરવી

Example:- The owner of company turned a deaf ear to all demands of employees.

039. **Half-hearted**

Meaning:- Having no enthusiasm or energy for a particular task

ગુજરાતી અર્થ:- કોઈ કાર્ય કરવા માટે ઉત્સાહ, જોશ કે સ્ફુર્તિનો અભાવ હોવો

Example:- John made a rather half-hearted attempt to clear GPSC examination.

040. **Barking up the wrong tree**

Meaning:- To take wrong or misguided action, especially to try or accuse the wrong person or thing.

ગુજરાતી અર્થ:- ખોટી દિશામાં કરવામાં આવતી શોધખોળ, ખોટી વ્યક્તિ પર લગાવવામાં આવતો આરોપ

Example:- Our advocate suggested that the investigation might be barking up the wrong tree.

041. **An iron will**

Meaning:- A very strong will

ગુજરાતી અર્થ:- મક્કમ મનોબળ

Example:- Nirupa's iron will and unswerving commitment put her on the top.

042. **In hot water**

Meaning:- Being in trouble, having a difficult situation, or often facing criticism for your actions or decisions.

ગુજરાતી અર્થ:- એવી ખરાબ પરિસ્થિતિ, મુશ્કેલી કે સમસ્યામાં ફસાઈ જવું કે જેની સજા મળવાની શક્યતા હોય

Example:- Prashant found himself in hot water over his comments about migration policy.

043. **Beat around the bush**

Meaning:- Avoiding talking about a topic directly or delaying getting to the main point, often because it is uncomfortable or sensitive.

ગુજરાતી અર્થ:- કોઈ વિષય વિશે સીધી વાત કરવાનું ટાળવું અથવા મુખ્ય મુદ્દા પર પહોંચવામાં વિલંબ કરવો. કારણ કે તે બાબત અસુવિધાજનક અથવા સંવેદનશીલ હોય છે.

Example:- Instead of beating around the bush, he should have addressed the issue directly.

044. **A light-fingered person**

Meaning:- A person who has a tendency to steal, especially by stealing or stealing. This is a sweet way of calling someone a thief.

ગુજરાતી અર્થ:- નાની વસ્તુઓ ચોરવાની આદત વાળો વ્યક્તિ

Example:- Be careful with your belongings around him; he's known to be a light-fingered person.

045. **Pin money**

Meaning:- A wife's allowance for her personal needs

ગુજરાતી અર્થ:- પત્નીના અંગત ખર્ચ માટેની રકમ

Example:- Manoj gave a little pin money to his wife.

046. **Best thing since sliced bread**

Meaning:- Something is outstanding, innovative, or extremely useful, often regarded as one of the greatest improvements or inventions ever made.

ગુજરાતી અર્થ:- સારામાં સારી યુક્તિ અથવા આયોજન, ઉત્તમ શોધ

Example:- The new software update is the best thing since sliced bread; it has made everything so much easier and faster!

047. **Plain sailing**

Meaning:- A plan or action that is simple and free from trouble

ગુજરાતી અર્થ:- અત્યંત સરળ કે મુશ્કેલી વગરનું કાર્ય કે આયોજન

Example:- There is plain sailing for Hemraj to win in chess tournament.

048. **A pep talk**

Meaning:- A short, encouraging speech intended to boost someone's morale, confidence, or enthusiasm, especially before a challenging task or situation.

ગુજરાતી અર્થ:- કોઈ વ્યક્તિનો ઉત્સાહ કે જુસ્સો વધારવા માટે કહેવામાં આવતી વાત

Example:- Yesterday I met Geeta for a pep talk, because I had my interview the very next day.

049. **A passing fancy**

Meaning:- A temporary liking for something or someone

ગુજરાતી અર્થ:- થોડા સમય માટે જ ગમાડવું/ પસંદ કરવું

Example:- I played few sports during collage, but they all were just passing fancies.

050. **To draw a blank**

Meaning:- To fail

ગુજરાતી અર્થ:- નિષ્ફળ જવું

Example:- Sanjay drew a blank in the lottery of life.

051. **Burn the midnight oil**

Meaning:- Working late into the night, often studying, reading or completing a task that requires a lot of effort and time.

ગુજરાતી અર્થ:- મોડી રાત સુધી અભ્યાસ કરવો, અભ્યાસ વિષયક પ્રવૃત્તિ કરવી

Example:- Radhika had to burn the midnight oil to prepare for her final exams.

052. **Cry over spilled milk**

Meaning:- Wasting time worrying or complaining about something that has already happened and cannot be changed.

ગુજરાતી અર્થ:- બની ગયેલી ઘટના પાછળ દુઃખી થવું

Example:- Neeta was unable to accept the reality of her divorce. She was crying over spilled milk.

053. **Curiosity killed the cat**

Meaning:- Being too curious can get you into trouble

ગુજરાતી અર્થ:- અતિ ઉત્સુકતા મુશ્કેલીમાં મુકે છે.

Example:- I know curiosity killed the cat, but I can't stop the investigation until I know where the donation are really going.

054. **Cut corners**

Meaning:- To take shortcuts, when something is done badly to save money

ગુજરાતી અર્થ:- કંઈ કરવા માટે ટુંકો રસ્તો અપનાવવો, ખાસ કરીને પૈસાની બચત કરવા માટે

Example:- The government was criticized to cut the corners in construction of public building.

055. **Cut the mustard**

Meaning:- Perform satisfactorily, to succeed

ગુજરાતી અર્થ:- સંતોષકારક દેખાવ કરવો, સફળ થવું

Example:- My friend Jayesh has applied for the post of architect in a big project, and he did cut the mustard.

056. **Devil's advocate**

Meaning:- To present a counter argument

ગુજરાતી અર્થ:- સતત દલીલબાજી કરવી

Example:- The plan is good, but I will play devil's advocate so that we know what the opposition can say.

057. **Elvis has left the building**

Meaning:- The show has come to an end, it is all over

ગુજરાતી અર્થ:- કાર્યક્રમ પૂરો થવાના આરે હોવો, કાર્યક્રમનો અંત હોવો

Example:- The event manager said, "I am sorry, Mr. Hemraj, you are late, Elvis has left the building.

058. **Far cry from**

Meaning:- Something is very different from something else or not at all similar. It highlights a significant contrast or disparity.

ગુજરાતી અર્થ:- કોઈ વસ્તુની સાપેક્ષમાં તદ્દન ભિન્ન હોવું, અલગ હોવું

Example:- Hemant's current lifestyle is a far cry from the one he had growing up in a small town.

059. **Feel a bit under the weather**

Meaning:- Feeling sick or unhealthy

ગુજરાતી અર્થ:- બીમાર અથવા અસ્વસ્થ હોવાનું અનુભવવું

Example:- I am feeling a bit under the weather, I think I am getting a cold.

060. **Give the benefit of doubt**

Meaning:- Believe someone's statement without proof.

ગુજરાતી અર્થ:- કોઈની રજૂઆત પૂરાવાઓ વગર માની લેવી

Example:- Even though Hiral was late, I decided to give her the benefit of the doubt and not assume she was being careless.

061. **To take to task**

Meaning:- Criticizing or reprimanding someone for their actions, behavior, or mistakes. This includes pointing out mistakes or shortcomings in a direct and severe way.

ગુજરાતી અર્થ:- વ્યક્તિની તેની ક્રિયાઓ, વર્તન અથવા ભૂલો માટે તેની ટીકા કરવી અથવા ઠપકો આપવો. આમાં સીધી કે ગંભીર રીતે ભૂલો કે ખામીઓ દર્શાવવાનો સમાવેશ થાય છે.

Example:- The teacher took him to task for not completing his assignment on time.

062. **To call for**

Meaning:- To require

ગુજરાતી અર્થ:- જરૂરી હોવું, ધ્યાન આપવા લાયક

Example:- The situation calls for considerable tact.

063. **To cut down**

Meaning:- To decrease

ગુજરાતી અર્થ:- ઘટાડવું

Example:- We must cut down our expenses.

064. **Hobson's choice**

Meaning:- A choice in which only one thing is offered and for that two options for choice- Accept or leave the offer.

ગુજરાતી અર્થ:- પસંદગી માટે કોઈ એક જ વિકલ્પ આપવો, અને તેનો ફરજિયાતપણે સ્વીકાર કરવો પડે અથવા જતું કરવું પડે

Example:- It is Hobson's choice for Rahul, if he doesn't accept new policy of company he will have to resign from the job.

065. **To crave for**

Meaning:- To yearn for

ગુજરાતી અર્થ:- ઝંખના કરવી

Example:- The old man in sorrow craves for sympathy.

066. **A storm in a teacup**

Meaning:- Exaggeration An exaggeration of a small problem or situation that is blown out of proportion. This means making a big fuss about something that is not important.

ગુજરાતી અર્થ:- મહત્વની ન હોય તેવી બાબતના લીધે અતિ ઉશ્કેરાઈ જવું, બિન જરૂરી ગુસ્સે થવું અને ચિંતા કરવી. તેનો અર્થ એ છે કે મહત્વની ન હોય તેવી કોઈ બાબત પર ભારે હોબાળો કરવો.

Example:- Hiral will not be angry for long, it is only a storm in teacup.

067. **To get rid of**

Meaning:- To get free from

ગુજરાતી અર્થ:- છુટકારો મેળવવો

Example:- The daughter in law wanted to get rid of the joint family.

068. **The pros and cons**

Meaning:- The advantages and disadvantages of something, or the positive and negative aspects. This is used when considering the merits and demerits of a situation, decision, or choice.

ગુજરાતી અર્થ:- કોઈપણ બાબતના હકારાત્મક અને નકારાત્મક પાસાઓ અથવા લાભ-ગેરલાભ

Example:- Before sign this agreement we will discuss the pros and cons.

069. **To bear in mind**

Meaning:- To Remember

ગુજરાતી અર્થ:- યાદ રાખવું

Example:- Students should always bear in mind the advice of their Teacher.

070. **Hear through the grapevine**

Meaning:- Learning something from rumors, gossip, or unofficial sources rather than from an official or direct source.

ગુજરાતી અર્થ:- હવામાં ઊડતા સમાચાર સાંભળવા, સત્તાવાર અથવા સીધા સ્ત્રોતને બદલે અફવા, ગપસપ અથવા બિનસત્તાવાર સ્ત્રોતોમાંથી કંઈક શીખવું.

Example:- I hear through the grapevine that Hardik was looking for work.

071. **Jump on the bandwagon**

Meaning:- Join a popular trend or activity

ગુજરાતી અર્થ:- લોકપ્રિય પ્રવાહ અથવા પ્રવૃત્તિમાં જોડાવું

Example:- After a politician won election by promising to reduce the inflation, most of others jumped on the bandwagon.

072. **Keep something at bay**

Meaning:- Keep something away

ગુજરાતી અર્થ:- સમસ્યારૂપ બાબતને પોતાનાથી દૂર રાખવી

Example:- The China was hit by a serious epidemic, but luckily Nirupa could keep himself at bay.

073. **Last straw**

Meaning:- The final problem or difficulty that causes a person to lose patience or finally give up after a number of problems or troubles. This is a turning point in a situation.

ગુજરાતી અર્થ:- સતત આવતી સમસ્યાઓમાં છેલ્લી સમસ્યા હોવી.

Example:- The constant delays were frustrating, but the last straw was when the meeting was canceled at the last minute.

074. **Let sleeping dogs lie**

Meaning:- Avoid stirring up trouble or reviving an old issue that could cause problems or conflict, especially when it might be better left unaddressed.

ગુજરાતી અર્થ:- દુઃખ કે મુશ્કેલી આપનાર બાબતને જતી કરવી, છોડી દેવી.

Example:- It's best to let sleeping dogs lie and not mention the old rumors at the meeting.

075. **Rain cats and dogs**

Meaning:- Too much heavy rain, raining tremendously

ગુજરાતી અર્થ:- મુશળધાર કે અતિ ભારે વરસાદ પડવો

Example:- We had to cancel the picnic because it started to rain cats and dogs.

076. **Harp on the same string**

Meaning:- Talking about the same topic or issue over and over again, often to the point of irritation, without considering that other people may be tired of hearing about it.

ગુજરાતી અર્થ:- એક જ વાતનું રટણ કર્યા કરવું, ગાણું ગાયા કરવું

Example:- She kept harping on the same string about her problems at work, and it became exhausting to listen to.

077. **Let the cat out of the bag**

Meaning:- To reveal a secret, to share information that was previously concealed

ગુજરાતી અર્થ:- પહેલાથી છુપાવેલું રહસ્ય છતું કરવું, બહાર પાડવું

Example:- Our MD did not let the cat out of the bag about deal until all the relevant contracts were signed.

078. **In black and white**

Meaning:- In writing, especially an agreement, contract or other format document

ગુજરાતી અર્થ:- લેખિતમાં

Example:- This is good for both us to have the agreement in black and white.

079. **In full swing**

Meaning:- Something is at its peak or most active state, usually referring to an event, activity, or process that is ongoing with full energy and intensity.

ગુજરાતી અર્થ:- પુરજોશમાં

Example:- When we got at Nilambaug, the party was in full swing.

080. **In good books**

Meaning:- Regarded favorably by one, thought of kindly or approvingly by one

ગુજરાતી અર્થ:- કોઈની કૃપા દ્રષ્ટિમાં હોવું

Example:- If you want to get in the teacher's good book, try to participate more in class.

081. **Leave no stone unturned**

Meaning:- To make every effort to achieve something, or to thoroughly explore or investigate every option without neglecting any detail.

ગુજરાતી અર્થ:- બનતું બધું જ કરી છૂટવું, કોઈ પ્રયત્ન બાકી ન રાખવો. કંઈક હાંસલ કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવા, અથવા કોઈપણ વિગતોની અવગણના કર્યા વિના દરેક વિકલ્પની સંપૂર્ણ શોધ અથવા તપાસ કરવી.

Example:- Radhika will leave no stone unturned in her efforts to get the project completed on time.

082. **Live from hand to mouth**

Meaning:- Living with very little money or resources, typically struggling to make ends meet and not having enough to save or plan for the future. This refers to a situation where people can only afford to meet their basic needs and are often in financial difficulty.

ગુજરાતી અર્થ:- ગરીબીમાં જીવવું, માંડ માંડ ગુજરાન ચલાવવું, ખૂબ ઓછા પૈસા અથવા સંસાધનો સાથે જીવવું, સામાન્ય રીતે જીવન જરૂરીયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરવો અને ભવિષ્ય માટે બચત યોજના બનાવવા માટે નાણાકિય અસમર્થતા હોવી.

Example:- Many workers in low-paying jobs are forced to live from hand to mouth, with little left over for savings.

083. **Nip in the bud**

Meaning:- To stop, or prevent something at the beginning or early phase, before it becomes too difficult or unmanageable

ગુજરાતી અર્થ:- ઉગતું જ ડામી દેવું

Example:- Many serious illness can be nipped in the bud if they are detected early enough.

084. **Off the cuff**

Meaning:- Without preparation, spontaneous

ગુજરાતી અર્થ:- કોઈ પણ તૈયારી વગર, સ્વયંભુ, સ્વયંસ્ફુરિત

Example:- A good politician is always able to speak off the cuff about government policy.

085. **On and off**

Meaning:- Occasionally, erratically, now and again

ગુજરાતી અર્થ:- થોડી થોડી વારે

Example:- I have had headache on and off since last night.

086. **See eye to eye with**

Meaning:- To agree with someone or have the same opinion or point of view on a particular matter.

ગુજરાતી અર્થ:- કોઈની સાથે સંમત થવું અથવા કોઈ ચોક્કસ બાબતે સમાન અભિપ્રાય અથવા દૃષ્ટિકોણ ધરાવવો.

Example:- I completely see eye to eye with you on this decision; it's the best choice.

087. **Smell a rat**

Meaning:- Suspect that something wrong is happening, realize that something is not as supposed to be

ગુજરાતી અર્થ:- શંકા આવવી/ હોવી

Example:- When Pravin made that offer, I smelt a rat. It sounded too good to be true.

088. **The ins and outs**

Meaning:- The detailed or complicated facts of something

ગુજરાતી અર્થ:- પુરેપુરી માહિતી

Example:- Akhilesh knows the ins and outs of that matter.

089. **The order of the day**

Meaning:- Something that is very common or important.

ગુજરાતી અર્થ:- રોજિંદી વાત કે સ્થિતિ, સામાન્ય બાબત

Example:- Hot strong tea is the order of the day here, but coffee is becoming more and more popular.

090. **Through thick and thin**

Meaning:- To support someone through good and bad time, to stay by someone's side over a long period of time, even when time is tough

ગુજરાતી અર્થ:- સારી કે ખરાબ પરિસ્થિતિમાં સાથ આપવો

Example:- Rajan has supported me through thick and thin.

091. **Tooth and nail**

Meaning:- To fight or struggle with great intensity, effort, or determination, often in a very fierce or aggressive way.

ગુજરાતી અર્થ:- ખુબ જ તીવ્ર પ્રયાસ, દ્રઢ સંકલ્પ સાથે લડવું અથવા સંઘર્ષ કરવો. પુરી તાકાતથી સામનો કરવો

Example:- Radhika fought tooth and nail to keep her business running during the difficult times.

092. **Once in a blue moon**

Meaning:- Very rarely, something that happens very seldom

ગુજરાતી અર્થ:- ભાગ્યે જ જોવા મળતું

Example:- My friend Amrat live in Canada, so I only see him once in a blue moon.

093. **To turn over a new leaf**

Meaning:- Making a fresh start or changing your behavior, usually for the better. This often refers to improving yourself or adopting a more positive attitude or lifestyle.

ગુજરાતી અર્થ:- જૂની આદતો કે વર્તનને બદલી હકારાત્મક આદત કે વર્તન અપનાવવું.

Example:- After the difficult year, he decided to turn over a new leaf and focus on his health and career.

094. **A bone of contention**

Meaning:- A topic, issue, or argument that causes disagreement, conflict, or dispute between people. It is something that causes ongoing conflict or tension.

ગુજરાતી અર્થ:- એક વિષય, મુદ્દો અથવા દલીલ જે લોકો વચ્ચે મતભેદ, સંઘર્ષ અથવા વિવાદનું કારણ બને છે. આ એવી બાબત હોય છે જે સતત સંઘર્ષ અથવા તણાવનું કારણ બને છે.

Example:- The division of assets was a bone of contention during the family meeting.

095. **A hard nut to crack**

Meaning:- A person, thing, situation or problem that is particularly difficult to understand, solve or deal with.

ગુજરાતી અર્થ:- ખુબ મુશ્કેલ બાબત.

Example:- Climbing Mount Everest is a hard nut to crack.

096. **To make up one's mind**

Meaning:- To make a final decision after a period of consideration.

ગુજરાતી અર્થ:- લાંબી વિચારણાનાં અંતે નિર્ણય કરવો.

Example:- Rajesh made up his mind to pass UPSC examination.

097. **Open the floodgates**

Meaning:- Allow something to happen a lot or allows many people to do something that was not previously allowed.

ગુજરાતી અર્થ:- કોઈ મોટી બાબત શક્ય બનાવવી અથવા પહેલા મનાઈ કરેલ બાબત કરવાની પરવાનગી આપવી

Example:- Ruling government are worried that allowing refugees into the country will open the floodgates to thousands more.

098. **To pull down**

Meaning:- To deliberately destroy

ગુજરાતી અર્થ:- તોડી પાડવું, નાશ કરવો

Example:- A big crowd attempted to pull down the statue of famous political leader.

099. **Deal with**

Meaning:- To occupy oneself or itself, to handle verbally or in some form of artistic.

ગુજરાતી અર્થ:- કોઈ વ્યક્તિની સાથે કામ પાડવું

Example:- It is very difficult to deal with a lazy man.

100. **To wrangle over an ass's shadow**

Meaning:- To quarrel over trivial and insignificant matters.

ગુજરાતી અર્થ:- સાવ મામુલી કે તુચ્છ બાબતમાં ઝઘડો કરવો

Example:- Only foolish people wrangle over an ass's shadow.

:: All the Best ::

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે સામાન્ય જ્ઞાનના વિડીયો
માટે અમારી YouTube ચેનલ GK Gujarat.Com જુઓ.

<https://www.youtube.com/@GKGujarat.Com1>